



RAN-2501001205020702

B. A. (NCF-NEP) (Sem. - V) Examination October - 2025 Economics (Paper - XII) Major - Macro Economics

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book.

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

- પ્ર. 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો (ગમે તે પાંચ) (10)
- એકમલક્ષી અર્થશાસ્ત્રનો અર્થ આપો.
 - કુલ રાષ્ટ્રીય પેદાશ અને ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ એટલે શું?
 - રાષ્ટ્રીય આવકની ફિશરની વ્યાખ્યા આપો.
 - વાસ્તવિક વેતન અને શ્રમની માંગ વચ્ચે કેવો સંબંધ છે?
 - કુલ માંગ કિંમત એટલે શું?
 - સરેરાશ અને સીમાંત વપરાશવૃત્તિનું સૂત્ર લખો.
 - રોજગારી ગુણકનું સૂત્ર લખો.
- પ્ર. 2. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? તેનું કાર્યક્ષેત્ર, મહત્વ અને મર્યાદાની ચર્ચા કરો. (13)
- અથવા
- પ્ર. 2. અ. રાષ્ટ્રીય આવકના અભ્યાસનું મહત્વ સમજાવો. (07)
બ. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં રહેલી મુશ્કેલીઓ ચર્ચો. (06)
- પ્ર. 3. મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો ખ્યાલ વિગતે સમજાવી તેને અસર કરતાં પરિબલો ચર્ચો. (13)
- અથવા
- પ્ર. 3 અ. જે.બી. સેનો બજારનો નિયમ સમજાવો. (07)
બ. પિગુનો વેતનકાપનો સિદ્ધાંત ચર્ચો. (06)
- પ્ર. 4. ટૂંકનોંધ લખો (ગમે તે બે) (14)
- એકમલક્ષી અર્થશાસ્ત્રનું મહત્વ અને મર્યાદા
 - રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિઓ
 - મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને મૂડીરોકાણ
 - મૂડીરોકાણ ગુણક

ENGLISH VERSION

- Q. 1. Answer the following questions briefly. (Any five) (10)**
1. Give the meaning of micro economics.
 2. What is Gross National Product and Net National Product?
 3. Give Fisher's definition of national income.
 4. What is the relationship between real wages and demand for labour?
 5. What is aggregate demand price?
 6. Write the formula for average and marginal propensity to consume.
 7. Write the formula for employment multiplier.
- Q. 2. What is macro economics? Discuss the scope, importance and limitations of it? (13)**
- OR**
- Q. 2. A. Explain the importance of study of national income. (07)**
B. Discuss the difficulties in calculating national income. (06)
- Q. 3. Explain in detail the concept of marginal efficiency of capital; discuss the factors affecting to it. (13)**
- OR**
- Q. 3. A. Explain the market theory of J. B. Say. (07)**
B. Discuss the wage cut theory of Pigou. (06)
- Q. 4. Write short note. (Any two) (14)**
1. Importance and limitations of micro economics
 2. Methods of calculating national income
 3. Marginal efficiency of capital and investment
 4. Investment multiplier
-